



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૭/૦૬/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૭૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૭ કેસ કરી, ૫૫ વ્યક્તિઓને ઝડપી, ૩૮૨ લીટર દેશી દારૂ અને ૩૪ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૯ કેસ કરી ૪૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮૭,૦૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૭૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૯૭૨/૧૯

ઘાટલોડીયા: કીરીટરાજ રામજીભાઈ સોલંકી (ઉ.વ.૬૫) (રહે. પંચવીલા ટાવર બી.ડી.રાવ હોલની બાજુમા મેમનગર) તા.૫/૬/૧૯ સવારના ૧૦/૩૦ વાગ્યાના સુમારે પારસનગર પાસે આવેલ વિનાયક પેટ્રોલ ખાતે આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ.ખાતે પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે મદદ કરવાના બહાને આવેલ એક પુરૂષે કીરીટરાજ સોલંકીના એ.ટી.એમ. પીન નંબર જાણી લઈ એ.ટી.એમ.કાર્ડ બદલી લઈ તા.૮/૫/૧૯ સુધીના સમયગાળા દરમ્યાન કીરીટરાજ સોલંકીના ખાતામાંથી રૂપિયા ૬૦,૦૦૦/- ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ અંગેની ફરીયાદ કીરીટરાજ સોલંકીએ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.આર.પટેલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૯૭૩/૧૯

અમરાઈવાડી: હીરાબહેન તે સોમાભાઈ અમથાઅભાઈ પટેલના વિધવા પત્ની (રહે. રામેશ્વર પાર્ક રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા ઓઢવ) તા.૬/૬/૧૯ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે અમરાઈવાડી રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તાથી શટલ ઓટોરિક્ષામાં બેસી અમરાઈવાડી પોસ્ટ ઓફીસ સામે મોટર કારના શો રૂમથી આગળ ઉતર્યા હતા ત્યારે મુસાફરી દરમ્યાન રિક્ષામાં બેઠેલ બે પુરૂષ અને એક મહીલાએ રિક્ષા ચાલકની મદદગારીથી હીરાબહેનની નજર ચુકવી સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂપિયા ૭૫,૦૦૦/- હાથમાંથી કાઢી ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ હીરાબહેને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એસ.મકવાણા ચલાવે છે.

વસ્ત્રાપુર: ગુરમીતસિંગ ઉજવલસિંગ ઢીંગરા (ઉ.વ.૪૪) (રહે.સન રાઇઝ પાર્ક સોસાયટી વસ્ત્રાપુર) એ અગમ્ય કારણસર તા.૬/૬/૧૯ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે લમણે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.ઈ.શ્રી એસ.આર.ગામીત ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.